



પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ શહેર.

શાહીબાગ, અમદાવાદ

વિશેષ શાખા, કચેરી ટેલીફોન નં-૦૭૯૨૫૬૩૩૪૦૦.

Email: Spll-ahd@gujarat.gov.in

### “કર્ફ્યુ હુકમ”

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે હુકમ  
નંબર-વિ.શા/ જાહેરનામું/ એ-સેક્શન/ ૧૮૨ / ૨૦૨૧. તા.૩૧/૧૨/૨૦૨૧

વંચાણે લીધા:- ગુજરાત સરકાર ગૃહવિભાગના પત્ર ક્રમાંક: વિ-૧/ કઅવ/ ૧૦૨૦૨૦/ ૪૮૨-A તા.૩૧/૧૨/૨૦૨૧  
આધારે.

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૭.૧૨.૨૦૨૧ ના હુકમ ક્રમાંક: 40-3/2020-DM-I(A) થી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તા.૨૧/૧૨/૨૦૨૧ ના હુકમ થી કોરોનાનો વ્યાપ અટકાવવા માટે અધતન સુચનાઓ આપવામાં આવેલ છે.

૨. રાજ્યમાં COVID-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૩૦.૧૧.૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/ કઅવ/ ૧૦૨૦૨૦/ ૪૮૨-A તથા હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તથા તા.૨૪/૧૨/૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કવ/૧૦૨૦૨૦/૪૮૨ થી રાજ્યના ૮ શહેરોમાં તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી રાત્રિ કર્ફ્યુ તથા કેટલાક નિયંત્રણો પૂર્વવત રાખવામાં આવેલ, જે સંદર્ભે અત્રેના જાવક પત્ર ક્રમાંક વિ.શા/ જાહેરનામું/એ-સેક્શન/ ૧૭૯(૧)/૨૦૨૧ તા.૨૪/૧૨/૨૦૨૧ ના હુકમથી અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ.

૩. ત્યારબાદ રાજ્ય સરકાર ગૃહ વિભાગના તા.૩૧.૧૨.૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/ કઅવ/ ૧૦૨૦૨૦/ ૪૮૨-A ના આદેશથી રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિની પુનઃ સમીક્ષા કરી પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારશ્રી દ્વારા અમદાવાદ શહેર સહિત રાજ્યના ૮ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ( દરરોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી સવારના ૦૫:૦૦ કલાક સુધી ) ની અવધિ તા.૦૭.૦૧.૨૦૨૨ સુધી લંબાવવા હુકમ કરેલ છે. જેથી ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઉક્ત હુકમો આધારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં, લોકોમાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતને લક્ષમાં લઈ અમદાવાદ શહેરમાં તા.૦૧.૦૧.૨૦૨૨ ના રાત્રિના ૧૧.૦૦ કલાકથી તા.૦૭.૦૧.૨૦૨૨ ના સવારના ૦૫.૦૦ કલાક સુધી (દરરોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી સવારના ૦૫:૦૦ કલાક સુધી ) રાત્રિ કર્ફ્યુ તેમજ નીચે જણાવ્યા મુજબના નિયંત્રણો પૂર્વવત અમલમાં રાખવામાં આવે છે.

આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૧૯૮૨ ના નોટીફિકેશન નં.જીજી/ ૪૨૨/ સીઆરસી/ ૧૦૮૨/ એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ ના સંકલીત જાહેરનામાં નં.જીજી/ ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે મને મળેલ સત્તાની રૂચે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ મુજબ ફરમાવુ છું કે, અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.૦૧.૦૧.૨૦૨૨ ના રાત્રિના ૧૧.૦૦ કલાકથી તા.૦૭.૦૧.૨૦૨૨ ના સવારના ૦૫.૦૦ કલાક સુધી ( દરરોજ રાત્રિના ૧૧:૦૦ કલાકથી સવારના ૦૫:૦૦ કલાક સુધી ) રાત્રિ કર્ફ્યુ તથા નીચે મુજબના નિયંત્રણો પૂર્વવત અમલમાં મુકવામાં આવે છે.જેથી અમદાવાદ શહેર વિસ્તારમાં લોકોએ કર્ફ્યુ દરમિયાન અંદર આવેલ જાહેર માર્ગ પર

નીકળવું નહી, કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી.

- રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.

- (૧) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર-જવરની છૂટ રહેશે.
- (૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવર-જવરની પરવાનગી આપવાની રહેશે.
- (૩) રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાન લઙ્ગ યોજી શકાશે નહી.
- (૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/ અધિકારીઓ/ કર્મચારીઓએ અવર-જવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
- (૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવર-જવરની પરવાનગી આપવાની રહેશે.
- (૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/ કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

#### ૪. નિયંત્રણો:

ગૃહ વિભાગના સમાન ક્રમાંકના હુકમથી અમદાવાદ શહેરમાં તા.૦૧.૦૧.૨૦૨૨ થી તા. ૦૭.૦૧.૨૦૨૨ સુધીના સમગ્ર સમયગાળા સુધી રાત્રિ કફર્યુ તથા નીચે મુજબના નિયંત્રણો પૂર્વવત અમલમાં મૂકવામાં આવે છે.

- A. તમામ દુકાનો , વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી /બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
- B. રેસ્ટોરેન્ડસ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન ચાલુ રાખી શકશે. Home delivery તથા Take away
- C. સિનેમા હોલ ૧૦૦% બેઠક ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
- D. જીમ ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન ચાલુ રાખી શકશે.
- E. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધીન ખુલ્લા રાખી શકાશે.
- F. આ સમયગાળા દરમિયાન લઙ્ગ માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૪૦૦ (ચારસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લઙ્ગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
- G. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજૂરી રહેશે.



- H. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
- I. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટરો/ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.
- J. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
- K. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચોજી શકાશે.
- L. વાંચનાલયો ૭૫% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે.
- M. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન.એ.સી.બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી.બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કફર્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
- N. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
- O. ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
- P. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૭૫% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
- Q. સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના ૦૯:૦૦ થી રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
- R. ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યક્તિઓના RTPCR ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં RTPCR ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની Discharge Summaryની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે. પ્રથમ ડોઝ લીધાને નિયત સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તો બીજો ડોઝ પણ લીધેલ હોય તે હિતાવહ રહેશે.

**-:અપવાદ:-**

૫. આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા / પ્રવૃત્તિઓ કોઇપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
- 1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
  - 2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
  - 3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.

- 4) ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
  - 5) શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ.
  - 6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
  - 7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
  - 8) ધરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
  - 9) ઈન્ટરનેટ/ ટેલિફોન/ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
  - 10) પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન.
  - 11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
  - 12) પોસ્ટ અને કુરીયર સર્વિસ
  - 13) ખાનગી સિક્યુરીટી સેવા
  - 14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
  - 15) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
  - 16) ઉક્ત તમામ આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
  - 17) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
  - 18) તમામ પ્રકારના ઉત્પાદન/ ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  - 19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૬. આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
૭. વધુમા તમામે નીચેની બાબતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

1. **FACE COVERING: WEARING OF FACE COVER IS COMPULSORY IN PUBLIC PLACES; IN WORKPLACES; AND DURING TRANSPORT.**
2. **SOCIAL DISTANCING: INDIVIDUALS MUST MAINTAIN A MINIMUM DISTANCE OF 6 FEET (2 GAZ KI DOORI) IN PUBLIC PLACES. SHOPS WILL ENSURE PHYSICAL DISTANCING AMONG CUSTOMERS.**
3. **SPITTING IN PUBLIC PLACES: WILL BE PUNISHABLE WITH FINE, AS PER EXISTING LAWS, RULES OR REGULATIONS.**



-:શિક્ષા:-

આ હુકમના લંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઈઓ, INDIAN PENAL CODE-1860 ની કલમ ૧૮૮ તથા THE DISASTER MANAGAMENT ACT- 2005 ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈઓ હેઠળ સજાને પાત્ર થશે.

-:જાહેર વિજ્ઞાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત નિર્દેશ કરેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ અમદાવાદ શહેર પોલીસના તમામ Social media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધી કરાવવી.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનામ હેડ.કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો લંગ કરનાર ઇસમો સામે THE EPIDEMIC DISEASES ACT-1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION , 2020 ની જોગવાઈઓ, INDIAN PENAL CODE-1860 ની કલમ ૧૮૮ તથા THE DISASTER MANAGAMENT ACT- 2005 ની જોગવાઈઓ હેઠળ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા.૩૦/૧૨/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



  
(સંજય શ્રીવાસ્તવ)  
પોલીસ કમિશ્નર  
અમદાવાદ શહેર

નકલ સવિનય રવાના:

- (૧) અગ્ર સચિવશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર, ગુજરાત સરકાર.
- (૨) અધિક મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજ્ય, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૩) પોલીસ મહાનિર્દેશક અને મુ.પો.અધિ.શ્રી, ગુ.રા, ગાંધીનગર.
- (૪) અધિક પો.મહાનિર્દેશકશ્રી(ઈન્ટે), ગુ.રા, ગાંધીનગર.
- (૫) પોલીસ કમિશનરશ્રી, સુરત, વડોદરા, રાજકોટ શહેર.
- (૬) મ્યુનિસિપલ કમિશનરશ્રી, અમદાવાદ શહેર.
- (૭) નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી, દાણાપીઠ, અમદાવાદ શહેર.
- (૮) કલેક્ટરશ્રી, અમદાવાદ શહેર.
- (૯) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા, ગાંધીનગર.
- (૧૦) સંયુક્ત માહિતી નિયામકશ્રી, બેરેક નં-૦૩, આંબાવાડી, પોલીટેકનીક, અમદાવાદ શહેર.
- (૧૧) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા, અમદાવાદ શહેર.

(૧૨) રજીસ્ટ્રારશ્રી, સિવિલ અને સેશન્સ કોર્ટ, અમદાવાદ શહેર.

(૧૩) રજીસ્ટ્રારશ્રી, સેશન્સ કોર્ટ, મીરઝાપુર, અમદાવાદ શહેર.

(૧૪) ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટશ્રી, અમદાવાદ શહેર.

(૧૫) મુખ્ય સરકારી વકીલશ્રી, સેશન્સ કોર્ટ, ભદ્ર, અમદાવાદ શહેર.

(૧૬) સંયુક્ત/ અધિક પોલીસ કમિશનરશ્રી, સેક્ટર-૧,૨/ કાઈમ બ્રાંચ/ મુખ્ય મથક/ ટ્રાફિક શાખા.

(૧૭) મેનેજરશ્રી, ગવર્નમેન્ટ પ્રેસ અને સ્ટેશનરી ડીપાર્ટમેન્ટ વડોદરા તરફ ગેજેટ ભાગ-૦૧ માં પ્રસિધ્ધ કરવા સારૂ

તેમજ પાંચ નકલો અત્રે વિશેષ શાખાને મોકલી આપવી, અમદાવાદ શહેર.

(૧૮) તમામ નાયબ પોલીસ કમિશનરશ્રીઓ, અમદાવાદ શહેર.

(૧૯) નાયબ પોલીસ કમિશનરશ્રી (ઈન્ટે), અમદાવાદ શહેર.

(૨૦) તમામ મદદનીશ પોલીસ કમિશનરશ્રીઓ, અમદાવાદ શહેર.

(૨૧) જનસંપર્ક અધિ.શ્રી, (સ્થાનિક વર્તમાન પત્રો તેમજ આકાશવાણી અને દુરદર્શન કેન્દ્ર ઉપરથી જાહેરાત કરવા)

(૨૨) તમામ પો.ઈન્સશ્રીઓ, અમદાવાદ શહેર. ( જાહેર જગ્યાઓએ નકલો ચોટાડી લાઉડ સ્પીકર વાહન દ્વારા

જાહેરાત કરાવવા સારૂ)

(૨૩) મદદનીશ પોલીસ કમિશનરશ્રી, એસ.ઓ.જી, અમદાવાદ શહેર.

(૨૪) પો.ઈન્સશ્રી, રેલ્વે એસ.ઓ.જી, કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ શહેર.

(૨૫) પો.ઈન્સશ્રી, અમદાવાદ રેલ્વે સ્ટેશન.

(૨૬) પો.ઈન્સશ્રી, સાબરમતી રેલ્વે સ્ટેશન.

(૨૭) પો.ઈન્સ.શ્રી કોમ્પ્યુટર શાખા, પોલીસ કમિ.શ્રીની કચેરી (C.P. Ahmedabad website ઉપર પ્રસિધ્ધ કરવા સારૂ.

(૨૮) મ.પો.કમિ.શ્રી સાયબર કાઈમ (અમદાવાદ શહેર પોલીસના તમામ Social Media પ્લેટફોર્મ પર પ્રસિધ્ધ કરવા સારૂ)





राजेश भूषण, आईएएस  
सचिव

**RAJESH BHUSHAN, IAS**  
SECRETARY



75  
Azadi Ka  
Amrit Mahotsav

भारत सरकार  
स्वास्थ्य एवं परिवार कल्याण विभाग  
स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय  
Government of India  
Department of Health and Family Welfare  
Ministry of Health and Family Welfare

D.O.No.Z.28015/318/21-EMR  
21 December, 2021

*Dear Colleague,*

This is regarding the measures that need to be taken in view of initial signs of surge in cases of Covid-19 as well as increased detection of the Variant of Concern (VoC), 'Omicron' in different parts of the country.

2. In this context kindly recall this Ministry's earlier guidance shared with States/UTs on multiple occasions regarding the recommended strategies for containment and restrictions, keeping the District as a unit.

3. At the **district level** there should be constant review of emerging data regarding the population affected by COVID-19, geographical spread, hospital infrastructure and its utilization, manpower, notifying Containment Zones, enforcement of perimeter of containment zones etc. This evidence should be the basis for effective decision making at the district level itself. Such a strategy ensures that infection is contained at the local level itself before it spreads to other parts of the state.

4. The main elements of the framework to be used by States and UTs to facilitate decision making at the District Level are as follows:

- i) Test positivity of 10% or more in the last one week
- OR
- ii) Bed occupancy of 40% or more on oxygen supported or ICU beds

In case any one of these parameters are met in any District, district level containment measures and restrictions may be put in place forthwith. Equally important, the restrictions must be strictly enforced.

5. Based on current scientific evidence, the VOC Omicron is at least 3 times more transmissible than the Delta VOC. Besides, the Delta VOC is still present in different parts of the country. Hence, even greater foresight, data analysis, dynamic decision making and strict & prompt containment action is required at the local and district level. The decision making at the State/UT and district level must be very prompt and focussed.

6. The template above provides a normative framework. However, based on the local situation and population characteristics such as density etc., and keeping in mind the higher transmissibility of Omicron, States/UTs can take containment measures and restrictions even before these thresholds are reached.

7. Some of the **strategic areas of intervention** focusing on containment, test, track, surveillance, clinical management, vaccination and Covid Appropriate Behaviour to be taken up are as follows:

North Block, New Delhi-110001  
Dated 27<sup>th</sup> December, 2021

**ORDER**


Whereas, an Order of even number dated 28<sup>th</sup> September 2021, was issued to ensure compliance with the containment measures for COVID-19, as conveyed *vide* Ministry of Health & Family Welfare (MoHFW) DO letter No. Z.28015/85/2021-DM Cell, dated 21<sup>st</sup> September, 2021, which was further extended for a period upto 31.12.2021 *vide* Order of even number, dated 30.11.2021;

And whereas, in view of the initial signs of surge in cases of COVID-19 as well as increased detection of the Variant of Concern (VoC), 'Omicron', in different parts of the country, MoHFW *vide* D.O. letter No. Z.28015/318/21-EMR, dated 21<sup>st</sup> December, 2021, has issued an advisory to all the States and Union Territories (UTs), prescribing a normative framework for taking evidence based containment measures at district/ local level;

Whereas, in exercise of the powers conferred under section 6(2)(i) of the Disaster Management Act, 2005 (DM Act), the National Disaster Management Authority (NDMA) has directed the undersigned to issue an Order, for containment of COVID-19 in the country;

Now, therefore, in exercise of the powers, conferred under Section 10(2)(I) of the DM Act, the undersigned, hereby directs the State/ UT Governments and State/ UT Authorities to consider implementation of the normative framework, as conveyed *vide* aforesaid MoHFW advisory, dated 21<sup>st</sup> December, 2021, as per **Annexure-I**, until 31.01.2022. States/ UTs will take necessary measures, under the relevant provisions of the DM Act. It is further directed that:

- (i) The National Directives for COVID-19 Management, as specified in **Annexure II**, shall continue to be strictly followed throughout the country.
- (ii) All the District Magistrates shall strictly enforce the above measures. For the enforcement of social distancing, State/ UT Governments may, as far as possible, use the provisions of Section 144 of the Criminal Procedure Code (CrPC) of 1973.
- (iii) Any person violating these measures will be liable to be proceeded against as per the provisions of Sections 51 to 60 of the DM Act, besides legal action under Section 188 of the IPC, and other legal provisions, as applicable.

  
Union Home Secretary  
and, Chairperson, National Executive Committee (NEC)

**To:**

1. The Secretaries of Ministries/ Departments of Government of India
  2. The Chief Secretaries/Administrators of States/Union Territories
- (As per list attached)



## **NATIONAL DIRECTIVES FOR COVID-19 MANAGEMENT**

1. **Face covering:** Wearing of face cover is compulsory in public places; in workplaces; and during transport.
2. **Social distancing:** Individuals must maintain a minimum distance of 6 feet (2 gaz ki doori) in public places.

Shops will ensure physical distancing among customers.

3. **Spitting in public places** will be punishable with fine, as may be prescribed by the State/ UT local authority in accordance with its laws, rules or regulations.

### ***Additional directives for Work Places***

4. **Work from home (WfH):** As far as possible the practice of WfH should be followed.
  5. **Staggering of work/ business hours** will be followed in offices, work places, shops, markets and industrial & commercial establishments.
  6. **Screening & hygiene:** Provision for thermal scanning, hand wash or sanitizer will be made at all entry points and of hand wash or sanitizer at exit points and common areas.
  7. **Frequent sanitization** of entire workplace, common facilities and all points which come into human contact e.g. door handles etc., will be ensured, including between shifts.
  8. **Social distancing:** All persons in charge of work places will ensure adequate distance between workers and other staff.
-

A - **Containment**: imposition of night curfew, strict regulation of large gatherings, curtailing numbers in marriages and funerals, restricting numbers in offices, industries, public transport etc. In case of all new clusters of Covid positive cases, prompt notification of "Containment Zones", "Buffer Zones" should be done, strict perimeter control of Containment Zone as per extant guidelines must be ensured. All cluster samples must be sent to INSACOG Labs for Genome Sequencing without delay.

B- **Testing and surveillance**: testing as per ICMR and MoHFW guidelines, door to door case search, testing of all SARI/ILI and vulnerable/co-morbid people, ensuring right proportion of RT-PCR tests in total tests being conducted daily, contact tracing of all Covid positive persons & their timely testing, utilizing the access to "AIR SUVIDHA" Portal by State Surveillance Officers (SSOs) & District Surveillance Officers (DSOs) to monitor the international passengers who have arrived in their States & Districts etc.

C- **Clinical Management**: increase bed capacity, other logistics like ambulances, mechanism for seamless shifting of patients, availability and operational readiness of oxygen equipments, buffer stock of drugs to be ensured by prompt utilization of Emergency Covid Response Package (ECRP-II) funds released by Central Government & other available resources etc. The existing National Clinical Management Protocol remains unchanged for Omicron.

Ensure stringent enforcement of home isolation as per extant guidelines. This would include among others: customized kit for persons undergoing home isolation, their regular monitoring through call centers as well as home visits etc. This will be a very critical activity in the days to come specially to ensure that persons under home isolation do not spread the virus to others in view of its higher transmissibility.

D- **Vaccination**: ensure 100% coverage of left out first and second dose eligible beneficiaries in an accelerated manner. Special focus to be given to those districts where the first & second dose coverage is less than the national average. The door-to-door vaccination campaign need to be strengthened.

E- **Community engagement and Covid Appropriate Behaviour**: Ensure advance engagement and information so that there is no misinformation or panic, transparent communication on hospital and testing infrastructure availability, regular press briefings etc. Participation of community backed by strict enforcement is necessary for ensuring Covid Appropriate Behaviour.

8. Kindly activate the War rooms/EOCs and keep analyzing all trends and surges, no matter how small and keep taking proactive action at the district/local level.

Regular reviews with field officers and proactive action in this regard will definitely control the spread of infection and flatten the curve.

*Warm Regards.*

Yours sincerely



(Rajesh Bhushan)

Chief Secretary/Administrator of all States / UTs